

ઘર માટે ભાષણ અને ભાષાના વિચારો

કુટુંબ તરીકે રાત્રિભોજન ખાય છે અને તમારા શ્રેષ્ઠ ભાષણ અને શ્રેષ્ઠ શિષ્ટાચારનો ઉપયોગ કરો. આ ઉચ્ચારણ, ભાષા, પ્રવાહ અને વ્યવહારિકતા (સામાજિક ઉપયોગ) માં મદદ કરે છે.

મોટેથી વાર્તાઓ વાંચો અને તમારી વાણીને ગતિ આપો. તમે જાઓ છો તેમ સિલેબલને ટેપઆઉટ કરી શકો છો અથવા તાળી પાડી શકો છો .

તમે વાંચેલી વાર્તાઓ વિશે વાત કરો અને દરેક પૃષ્ઠ અથવા ફક્ત પછી " WH " પ્રશ્નો પૂછો . (ઉદા. પાત્ર કોણ હતું, તેઓ શું કરી રહ્યા હતા, વાર્તા ક્યાં બની રહી છે, ક્યારે બન્યું, વાર્તાનો અંત કેવી રીતે થયો?)

કહો શું શબ્દો બાળક હોતી * ટી વાર્તા સમજવા અને સાથે મળીને શબ્દ જુઓ. શબ્દનો ઉપયોગ કરો અથવા વિદ્યાર્થીને તે શબ્દનો ઉપયોગ પુસ્તકાર માટે કરો.

તમારા ભાષણ અવાજનો ઉપયોગ કરીને શબ્દ સૂચિઓ બનાવો.

તમારા ઘરની આજુબાજુમાં તમારા ભાષણ અવાજ સાથે પદાર્થોની શોધમાં શિકાર કરો.

અવિવેકી જોડકણાં બનાવો .

જો બાળકની વાણી અવાજની મુશ્કેલીઓ યોગ્ય હોય ત્યારે ધ્વનિને સુધારે છે. જો તમારું બાળક આ ન્યાયની ધીમી વાણીને સુધારવાને બદલે હલાવે છે.

સૌથી અગત્યનું માત્ર વાત કરો! તમે જોશો તે વિશે વાત કરો, હોમવર્ક વિશે વાત કરો, કટોકટી ચાલી રહી છે તે વિશે વાત કરો! કોઈપણ વાણી અથવા ભાષાની મુશ્કેલી માટે વાત કરવી અને સાંભળવી એ કી છે અને તે વૃદ્ધિ લાવશે. કોઈપણ પ્રશ્નો સાથે મને ઇમેઇલ મફત લાગે કૃપા કરીને. તમારું ભાષણ અથવા ભાષા શિક્ષક આ સમય દરમિયાન તમારો સંપર્ક કરશે અને વધુ સૂચનો અને સહાય આપશે!
ક્રિસ્ટી ફ્લોરેસ એમએસ સીસીસી-એસએલપી

christy.flores@hcsk12.net

વેબસાઇટ્સ:

વાર્તાઓ અને ભાષાના વિચારો: www.mommyspeechtherap.com

ભાષણ અને ભાષાનું હોમ થેરેપી: <https://www2.ed.gov/pubs/CompactforReading/tablek.html>

હલાવવું: www.stutteringhelp.org

આશા અમેરિકન ભાષણ અને સુનાવણી મંડળ) માતાપિતા માટે સૂચનો: <https://www.asha.org/public/speech/deવિકાસ ment/suggestions/>

